

યોજનાકીય માહિતી

યોજનાકીય સિધ્ધિઓની સકસેસ સ્ટોરી અને તે અંગેના ફોટોગ્રાફ:-

મેલેરીયા નિવારણ કાર્યક્રમ માહીયા, તથા ધન્વંતરી જન્મ જયંતી દિવસે ” રન ફોર આયુર્વેદા “કાર્યક્રમ, આયુષ ગ્રામ પ્રકલ્પ દિહોર, મર્મ ચિકિત્સા અને અગ્નિકર્મ ચિકિત્સા ના કેમ્પ અન્ય નિદાન કેમ્પ, જરા-ચિકિત્સા, સ્વસ્થવૃત શિબિર, ઉકાળા વિતરણ, વનસ્પતિ પ્રદર્શન નુ આયોજન કરવામાં આવેલ

● નિદાન કેમ્પ :-

આ કાર્યક્રમ અંતર્ગત લોકોનું સ્વાસ્થ્ય સુધરે તે માટે લોકોને અનુકૂળ હોય તેવી જગ્યાએ જઈને કેમ્પનું આયોજન કરી તેમને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. દરેક લાભાર્થીને સર્વ રોગોનું નિદાન તથા વિનામૂલ્યે દવા આપવામાં આવે છે. વર્ષ વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત કેમ્પ કરવામાં આવેલ જે અન્વયે ૧૭૦૦૦ લાભાર્થીએ લાભ લીધેલ છે.

● જરા-ચિકિત્સા:-

આ કાર્યક્રમ અંતર્ગત દરેક આયુર્વેદ દવાખાનાઓમાં અઠવાડીયામાં બે દિવસ ૬૦ વર્ષ થી મોટી ઉંમરના લોકોને ખાસ ઓપિડી સારવારમાં “ રસાયન ટેબલેટ ” (રોગપ્રતિકારક શક્તિવર્ધક) તથા અન્ય ઔષધી આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત ૩૦૬૪૫ લાભાર્થીએ લાભ લીધેલ છે.

● સ્વસ્થવૃત શિબિર :-

આ કાર્યક્રમ અંતર્ગત દરેક આયુર્વેદ દવાખાનાઓમાં તથા આસપાસના ગામોમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે સ્વસ્થવૃત શિબિરનું આયોજન કરવામાં આવે છે તથા શાળાઓ અને આંગણવાડી માં ચિકિત્સક દ્વારા બાળકોની નિયમીત આરોગ્ય તપાસ કરી ને વાલીઓ અને શિક્ષકો ને સ્વસ્થવૃત અંગે નુ માર્ગદર્શન આપવામાં આવે છે તથા બાલરસાયણ ચૂર્ણ નુ વિતરણ કરવામાં આવે છે. આ સ્વાસ્થ્ય શિબિર અંતર્ગત સ્વસ્થ માણસનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે લોકોને આહાર-વિહાર, ઋતુ ચર્યા વગેરે આયુર્વેદમાં બતાવેલ રોગપ્રતિકારક ઉપાયોનું વિશેષ જ્ઞાન આપવામાં આપે છે. વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત આવી શિબિરો કરવામાં આવેલ જે અન્વયે ૮૧૦૭૪ લાભાર્થીએ લાભ લીધેલ છે.

● વનસ્પતિ પ્રદર્શન :-

આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા ઉપયોગી વનસ્પતિના નમુના તૈયાર કરવામાં આવેલ છે. જેનું પ્રદર્શન દવાખાનામાં, જાહેર સ્થળો તથા નિદાન કેમ્પમાં કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત અંદાજે ૧૬૦૦૦ લોકોએ પોતાની આસપાસની વનસ્પતિ વિશે માહિતી મેળવેલ છે.

● ઉકાળા વિતરણ :-

આ કાર્યક્રમ અંતર્ગત દરેક આયુર્વેદ દવાખાનાઓમાં તથા અન્ય જગ્યાઓએ સ્વાસ્થ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ છે. ઉકાળાથી રોગપ્રતિકારકશક્તિમાં વધારો થાય છે. વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત ૧૧૯૭૧૯ લાભાર્થીએ લાભ લીધેલ છે.

- **સુવર્ણ પ્રાશન :-**

સુવર્ણપ્રાશન કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૨ વર્ષ ના બાળકો ને પુષ્ટ નક્ષત્ર ના દિવસે સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦ સુધી અંદાજે ૧૬૧૫૩૩ બાળકોએ લાભ લીધેલ છે.

- **અગ્નિકર્મ ચિકિત્સા:-**

આયુર્વેદમાં અગ્નિકર્મ (cauterization) ચિકિત્સાથી કપાસી (Corn), સંધિવાત (Osteoarthritis), Cervical spondiolosis અને sciatica જેવા રોગોમાં કોઇપણ જાતના એનેસ્થેશિયા વગર ચિકિત્સા કરવામાં આવે છે. જેમાં દર્દિને રક્ત સ્ત્રાવ કે પીડા વગર તુરંત જ પાંચ થી સાત મીનિટમાં સારા પરિણામ મળે છે અગ્નિકર્મ સારવાર માટેના કુલ પાંચ કેમ્પ કરવામાં આવેલ છે. જેમાં એકદરે ૬૬૨ દર્દિને સારવાર આપેલ છે.

- **વંધ્યત્વ અને ચામડીના રોગમાં આયુર્વેદ સારવાર દ્વારા શ્રેષ્ઠ પરિણામ:-**

આયુર્વેદ ચિકિત્સાથી અન્ય રોગ ઉપરાંત કષ્ટ સાધ્ય એવા ચામડી અને વંધ્યત્વના રોગોમાં ઉત્તમ પરિણામ મેળવેલ છે.